

અરજી નંબર :-

ધિરાણ મેળવવા માટેનું અરજી પત્રક
વાહન સિવાયની યોજનાઓ માટે

તબદીલને પાત્ર નથી)
વિના મૂલ્યે



રાષ્ટ્રિય અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્હી (એન.એસ.એફ.ડી.સી.)

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન

બ્લોક નં. ૧૦, બીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.

યોજનાનું નામ :-

તાજેતરનો
પાસપોર્ટ
સાઈઝનો ફોટો
(અરજદારે ફોટા
ઉપર સહી કરવી.)

(૧) અરજદારની વિગત :-

- (૧) પુરેપુરું નામ :-
- (૨) સરનામું :-
- (૩) જન્મ તારીખ :- (આધાર રજૂ કરવો) ઉંમર (જાહેરાતની તારીખે)
- (૪) કુટુંબના સભ્યોની સંખ્યા :- તે પૈકી કમાતા સભ્યોની સંખ્યા :-
- (૫) કુટુંબના સભ્યોની વાર્ષિક આવક રૂ. (સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ આવકના દાખલાની પ્રમાણિત નકલ સામેલ કરવી)
(અ) ઉદ્યોગ ધંધામાંથી :- રૂ. (બ) જમીન ખેતીમાંથી :- રૂ.
(ક) નોકરીમાંથી :- રૂ. (ડ) છુટક મજૂરી/ અન્ય વિ. :- રૂ.
કુલ આવક :- રૂ.
- (૬) અરજદારની જાતિ તથા પેટા જાતિ (સક્ષમ અધિકારીશ્રીના દાખલાની પ્રમાણિત નકલ સામેલ કરવી)
- (૭) શૈક્ષણિક લાયકાત :- (આધાર રજૂ કરવો)
- (૮) બી.પી.એલ. યાદી નં. :- (આધાર રજૂ કરવો)
- (૯) વિધવા/ ત્યકતા/ વિકલાંગ હોય તો તેની વિગત (આધાર રજૂ કરવો)
- (૧૦) અરજદારે કે તેઓના કુટુંબના અન્ય સભ્યએ અગાઉ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની યોજનાઓ કે અન્ય સરકારી એજન્સી મારફત લોન / સહાય મેળવેલ છે કે કેમ ? તેની વિગતો આપવી.
.....
- (૧૧) અ. ધંધાને અનુરૂપ કરેલ કોર્સ / તાલીમ ની વિગત.
(૧)
(૨)
બ. ધંધાને અનુરૂપ અનુભવની વિગત.
(૧)
(૨)
ક. ધંધા લોનની જરૂરીયાત. (સાધન- સામગ્રી, સરંજામ તથા કાર્યકારી મૂડી ની વિગતો એક અલગ પેપર ઉપર દર્શાવી અરજી સાથે સામેલ રાખવી.)
(૧) સાધન સામગ્રી - સરંજામ માટે રૂ.
(૨) કાર્યકારી મૂડી માટે રૂ.
કુલ રૂ.
- (૧૨) (અ) ધંધાને અનુરૂપ જગ્યા ધરાવો છો કે કેમ ? હા / ના જો હા, તો તેની વિગત
(આધાર રજૂ કરવા)
(બ) લોન મળ્યા બાદ ધંધાના આયોજન તથા માર્કેટીંગની વિગત :-
- (૧૩) સ્થાવર મિલકત ધરાવો છો કે કેમ ? હા / ના હા તો અંદાજીત રકમ રૂ.
(જમીન / મકાનના આધાર રજૂ કરવા.)
- (૧૪) ટેલીફોન નંબર (એસ.ટી.ડી. કોડ સાથે) મોબાઈલ નંબર :-
- (૧૫) બેન્ક ખાતાની વિગત :- (અ) બેન્કનું નામ :- (બ) શાખાનું નામ :-
(ક) ખાતાનો નંબર :- (ડ) ખાતાનો પ્રકાર :- બચત ખાતું/ ચાલુ ખાતું

સાક્ષીની સહી :-

નામ :-

સરનામું :-

અરજદારની સહી :-

નામ :-

બાંહેધરી પત્રક

૧. આથી હું પ્રમાણિત કરુ છું કે, અરજીના નમૂનામાં જે કોઈ વિગતો દાખલા આપેલ છે, તે મારી જાણ પ્રમાણે તદ્દન સાચી છે. તેમાં પાછળથી કોઈપણ વિગત સાચી ન હોવાનું સાબિત થાય તો મળેલ લોનની રકમ એક સાથે ભરપાઈ કરવા બંધાઉં છું અને તે બદલ ખાત્રી આપું છું.
૨. લોન લેવા માટે એન.એસ.એફ.ડી.સી., નવી દિલ્હી અને ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર તરફથી જે કંઈ શરતો બોલીઓ નક્કી થશે તે પ્રમાણે વર્તવા આથી હું બાંહેધરી આપું છું.
૩. આ અગાઉ મેં કે મારા કુટુંબની અન્ય કોઈ વ્યક્તિએ નિગમ/કોઈપણ સરકારી / અર્ધ સરકારી કચેરી કે બેન્ક પાસેથી વાહન ખરીદવા અથવા અન્ય ધંધા માટે કોઈપણ પ્રકારનું ધિરાણ મેળવેલ નથી કે માંગણી કરેલ નથી તે બદલ ખાત્રી આપું છું. જેમાં કંઈ પણ કસૂર થશે તો નિગમ કાયદેસર કાર્યવાહી કરવા કુલ મુખત્યાર છે. ધિરાણ મળેથી નિયમિત હપ્તા ભરવા, તે દરમ્યાન નિગમને મારું વાહન / સાધનો હાઈપોથીકેશનમાં રાખવા અને નાણાં સમયસર ન ભરવા માટે રેવન્યુ રાહે વસુલાત લેવા અને દંડનીય વ્યાજ સાથે ભરપાઈ કરવા બંધાઉં છું તે માટે હું તેમજ મારા વંશ વારસો જવાબદાર રહેશે તે હું પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું.

સાક્ષી : તલાટી / સરપંચ / રાજ્ય પત્રિત અધિકારી / ધારાસભ્યશ્રી

સહી :—

અરજદારની સહી :—

નામ :—

નામ :—

સરનામું :—

ધિરાણ મેળવવા અંગે સુચનાઓ અને શરતો

૧. આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિની અને ગુજરાત રાજ્યના વતની હોય તે લોકોને જ આપવામાં આવશે.
૨. અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૨૧ વર્ષથી નીચે અને ૫૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
૩. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારોમાં રૂા. ૮૧,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂા. ૧,૦૩,૦૦૦/- થી વધુ હોવી જોઈએ નહીં.
૪. આ અરજી ફોર્મ જે વ્યક્તિને આપવામાં આવેલ છે તે વ્યક્તિએ જ ઉપયોગ કરવાનો રહેશે. અન્ય કોઈ વ્યક્તિ ઉપયોગ કરી શકશે નહીં.
૫. સાધનો આગ, અકસ્માત, ચોરી, હુલ્લડ અને કુદરતી આફતો / આતંક વિગેરે સામે રક્ષણ મળે તે માટે દર વર્ષે લાભાર્થીએ પ્રિમિયમ ભરી વિમો રીન્યુ કરવાનો રહેશે અને વિમા પોલીસી નિગમના નામે એસાઈન કરાવવાની રહેશે.
૬. સાધનોનું નિગમની તરફેણમાં હાઈપોથીકેશન કરી આપવાનું રહેશે તથા નિગમ તરફથી નકકી કરેલ બાહેધરી / જામીનખત વગેરે ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
૭. લોન પરત ભરપાઈ કરવા માટે અંગત જામીનગીરી ખત આપવાના રહેશે. તથા યોજનાના નિયમો મુજબ માંગણી થયેથી વસુલાત પેટે ચેક આપવાના રહેશે.
૮. જ્યાં સુધી લોનની રકમ વ્યાજ સહિત પુરેપુરી ભરપાઈ ન થાય ત્યાં સુધી અરજદાર સાધનો અન્ય વ્યક્તિને વેચી શકશે નહીં કે ગીરો મૂકી શકશે નહીં કે અન્યને તબદીલ કરી શકશે નહીં.
૯. નિગમ તરફથી ધિરાણ કરવામાં આવેલ રકમ ઉપર નિયત દરે વ્યાજ લેવામાં આવશે. તથા નિગમ નકકી કરે તે પ્રમાણે લોન હપ્તા દર માસે નિગમની જીલ્લા કચેરીમાં જમા કરાવવાના રહેશે. જો સમયસર હપ્તા નહીં ભરવામાં આવે તો નિગમ નકકી કરે તે મુજબ દંડનીય વ્યાજ લેવામાં આવશે.
૧૦. ડયુ થયેલ હપ્તા ભરવામાં નહીં આવે તો ડીફોલ્ટર પાસેથી નિગમ તરફથી વધારાનો જે વ્યાજનો દર નકકી થાય તે પ્રમાણે દંડનીય વ્યાજ લેવામાં આવશે.
૧૧. ચડત થયેલ સળંગ ત્રણ હપ્તાઓ ભરવામાં નહીં આવે તો નિગમ તરફથી વાહન / સાધનો પરત લઈ, તેની હરાજી કરી બાકીની રકમ અરસપરસ ધોરણે વસુલ લેવા નિગમ હકકદાર રહેશે.
૧૨. કોઈપણ એજન્સી / નિગમ / સંસ્થા પાસેથી અગાઉ લોન / સહાય લીધેલ હોય તો તેની વિગત આપવી. જો તેમાં ચૂક થશે તો અપાયેલ તમામ રકમ વ્યાજ સહિત એક સાથે વસુલ લેવામાં આવશે તથા અપાયેલ વાહન / સાધનો જપ્ત કરવામાં આવશે.
૧૩. કોઈપણ કારણસર લોન અરજી ફોર્મ ભર્યા બાદ નિર્ણય કરવા માટે કે નિર્ણય થયા બાદ લાભાર્થીને ધિરાણ આપવામાં વિલંબ થશે તો તે માટે કોર્પોરેશન જવાબદાર રહેશે નહીં.
૧૪. આવેલ અરજીઓની સંખ્યા તથા તેની ગુણવત્તાને ધ્યાને લઈને અરજી મંજૂર કે નામંજૂર કરવાની સત્તા કોર્પોરેશનની રહેશે. આ અંગે કોઈપણ જાતની તકરાર કે કોર્ટ વિવાદ ચાલશે નહીં તથા કોઈ પત્ર વ્યવહાર કરવો નહીં.
૧૬. માલિકીની ખેતીની જમીનના કિસ્સામાં જમીન બોજા મુક્ત હોવી જોઈએ અને ધિરાણ મેળવે નિગમની તરફેણમાં જમીન ગીરોખત કરી આપવાની રહેશે.
૧૭. નિગમ તરફથી અન્ય વિગતો બોલીઓ અને શરતો વખતો વખત નકકી થશે તે કબુલ કંજૂર રાખવાની રહેશે.

ઉપરના તમામ નિયમો / શરતો મેં ધ્યાન પૂર્વક વાંચ્યા છે અને તે વાંચી સમજીને તે મને તેમજ મારા વંશ વારસોને કબૂલ મંજૂર છે. તેવી કબૂલાત આપું છું.

સાક્ષીની સહી :—.....

અરજદારની સહી :—.....

નામ :—.....

નામ :—.....

સરનામું :—

તારીખ :—.....

**અરજી ચકાસણી અંગેની વિગત
(ફક્ત કચેરીના ઉપયોગ માટે)**

૧. લોન અરજી ફોર્મ સાથે રજુ થયેલ સાધનિક કાગળો અંગે સ્થળ ચકાસણી કર્યા બાદ નીચે મુજબનો અભિપ્રાય આપવો.

ક્રમ	વિગત	હા / ના
૧.	અરજદાર દર્શાવેલ સરનામે રહે છે ?	
૨.	અરજદારે અરજીમાં જણાવેલ વિગતો બરાબર છે ?	
૩.	અરજી ફોર્મ સાથે સામેલ દસ્તાવેજની ચકાસણી અસલ પ્રમાણપત્ર સાથે કરેલ છે તે બરાબર છે ?	
૪.	અરજદારે જાતિનો દાખલો તથા કુટુંબની વાર્ષિક આવકનો દાખલો સક્ષમ અધિકારીશ્રીનો જોડેલ છે ?	
૫.	ઘંઘાને અનુરૂપ કોર્સ / તાલીમ બાબતે અભિપ્રાય ૧ ૨	
૬.	દર્શાવેલ ઘંઘો તથા તેના સ્થળ મુજબ ઘંઘાની પોષણક્ષમતા બાબતે અભિપ્રાય	
૭.	અન્ય કોઈ વિગત હોય તો (જો હા હોય તો)	
૮.	લોન અરજી મંજૂર કરવા માટેનો સ્પષ્ટ અભિપ્રાય	

સ્થળ :- ચકાસણી કરનારની સહી :-

તારીખ :- નામ :-

હોદ્દો :-

(૨) અરજી ફોર્મના સાધનિક કાગળો તથા જીલ્લા કચેરીના રેકર્ડ મુજબ ચકાસણી બાદ અરજદારને ધિરાણ કરવા બાબતે જીલ્લા મેનેજરશ્રીનો જીલ્લા કક્ષાની કમિટીમાં ભલામણ કરવા બાબતે અભિપ્રાય

સ્થળ :- જીલ્લા મેનેજરની સહી :-

તારીખ :- નામ :-

(૩) જીલ્લા કક્ષાની પસંદગી સમિતિનો અરજી ભલામણ કરવા બાબતે અભિપ્રાય

સ્થળ :- જીલ્લા મેનેજરની સહી :-

તારીખ :- નામ :-